



HCR-002-001513 Seat No. _____
B. Com. (Sem. V) (CBCS) Examination
October - 2017
Advanced Statistics : Paper - V

Faculty Code : 002
Subject Code : 001513

Time : $2\frac{1}{2}$ Hours] [Total Marks : 70

સૂચના : (1) બધા જ પ્રશ્નોના ઉત્તરો મુજ્ય ઉત્તરવહીમાં જ લખવાના છે.
(2) બધા જ પ્રશ્નો ફરજિયાત છે.

1 (અ) સમજાવો :

- | | |
|--|----|
| (1) ગુરુનિદર્શ અને લઘુનિદર્શ વચ્ચે તફાવત જણાવો. | 5 |
| (2) પ્રકાર-I અને પ્રકાર-II ભૂલ સમજાવો. | 5 |
| (બ) નીચેની માહિતી પરથી બે નિદર્શોના મધ્યકો વચ્ચેના તફાવતની સાર્થકતાનું 10
પરીક્ષણ કરો : | 10 |

વિગત	નિદર્શ-I	નિદર્શ-II
કદ	121	81
સરેરાશ	87	84
વિચરણ	100	144

અથવા

- 1 (અ) સમજાવો :** 10
(1) નિરાકરણીય પરિકલ્પના
(2) સ્વાતંત્ર્યની માત્રા.
(બ) નીચેની માહિતી પરથી બે પ્રમાણિત વિચલનો વચ્ચેના
તફાવતની સાર્થકતાનું પરીક્ષણ કરો :

વિગત	નિદર્શ-I	નિદર્શ-II
કદ	200	300
સરેરાશ	2.22	3.21
પ્ર.વિ.	1.2	1.4

- 2 (અ) F-પરીક્ષણ પર ટૂંક નોંધ લખો. 10
 (બ) બે પ્રમાણ્ય સમાચિત્તમાંથી બે નિદર્શો લેવામાં આવ્યા છે. આ બંને નિદર્શાના વિચરણો સમાન છે કે નહિ તેની સાર્થકતાનું પરીક્ષણ કરો :

નિદર્શ : I	21	17	26	29	24	23	18	26	25	21		
નિદર્શ : II	28	24	42	37	33	35	39	29	42	44	30	37

અથવા

- 2 (અ) t-પરીક્ષણ પર ટૂંક નોંધ લખો. 10
 (બ) બે પ્રમાણ્ય સમાચિત્તમાંથી બે યદચ્છ નિદર્શો લેતાં નીચે મુજબના પરિણામો મળે છે. બંને નિદર્શો એક જ પ્રમાણ્ય સમાચિત્તમાંથી લીધેલા છે કે કેમ તે t-પરીક્ષણથી નક્કી કરો.

નિદર્શ - 1	82	55	35	60	90	110	78	85	75	80	
નિદર્શ - 2	80	82	40	60	64	90	110	50			

- 3 (અ) 2×2 સંભાવના કોષ્ટક $\begin{matrix} 20 & x \\ x & 20 \end{matrix}$ માટે ગણતરીથી કાય વર્ગની કિંમત 10

$$\frac{20}{3} \text{ છે. તો } x\text{ની કિંમત શોધો.}$$

- (બ) બે ગુણધર્મની સ્વતંત્રતાનું પરીક્ષણ સમજાવો. 5

અથવા

- 3 નીચેની માહિતી માટે પોયસન વિતરણાનું અન્વાયોજન કરો અને તેની યોગ્યતાનું 15 પરીક્ષણ કરો.

$x:$	0	1	2	3	4
$f:$	122	60	15	2	1

- 4 (અ) “વિચરણાનું પૃથક્કરણ” પર ટૂંક નોંધ લખો. 5
 (બ) નીચેની માહિતી પરથી વિચરણાનું પૃથક્કરણ કરો : 10

A	6	7	3	8
B	5	5	3	7
C	5	4	3	4

અથવા

4 નીચેની લેટિન ઓરસ પોજના માટે વિચરણાનું પુથક્કરણ કરો : 15

A(5)	B(4)	C(3)	D(3)	E(2)
B(6)	C(5)	D(2)	E(1)	A(3)
C(8)	D(6)	E(5)	A(5)	B(4)
D(7)	E(8)	A(7)	B(4)	C(5)
E(9)	A(7)	B(7)	C(2)	D(9)

ENGLISH VERSION

Instructions : (1) Write the answers of All questions in main answer book.
 (2) All questions are compulsory.

- 1 (a) Explain : 5
 (1) State the difference between small and large sampling tests.
 (2) Explain Type I and Type II errors. 5
 (b) Test the significance difference between two sample means from the following data. 10

Details	Sample I	Sample II
Size	121	81
Average	87	84
Variance	100	144

OR

- 1 (a) Explain : 10
 (1) Null Hypothesis
 (2) Degrees of freedom.
 (b) Test the significance difference between two, standard deviations from the following data. 10

Details	Sample I	Sample II
Size	200	300
Average	2.22	3.21
S.D.	1.2	1.4

- 2 (a) Write short note on F-test. 10
 (b) Two samples are drawn from two normal populations. 10
 Test the significance of equality of two variances :

Sample : I	21	17	26	29	24	23	18	26	25	21		
Sample : II	28	24	42	37	33	35	39	29	42	44	30	37

OR

- 2** (a) Write short note on t-test. **10**
 (b) Two random samples are drawn from the normal populations and data are given below : **10**

Sample - 1	82	55	35	60	90	110	78	85	75	80
Sample - 2	80	82	40	60	64	90	110	50		

- 3** (a) For 2×2 contingency table $\begin{array}{|c|c|} \hline 20 & x \\ \hline x & 20 \\ \hline \end{array}$ calculated. **10**

value of Chi-square is $\frac{20}{3}$. Find the value of x .

- (b) Explain the test of two independent attributes. **5**

OR

- 3** Fit the Poisson distribution to the following data and test the goodness of fitness : **15**

$x:$	0	1	2	3	4
$f:$	122	60	15	2	1

- 4** (a) Write short note : “Analysis of Variance”. **5**
 (b) Analysis of variance for the following data. **10**

A	6	7	3	8
B	5	5	3	7
C	5	4	3	4

OR

- 4** Analyze the following L.S.D. data completely. **15**

A(5)	B(4)	C(3)	D(3)	E(2)
B(6)	C(5)	D(2)	E(1)	A(3)
C(8)	D(6)	E(5)	A(5)	B(4)
D(7)	E(8)	A(7)	B(4)	C(5)
E(9)	A(7)	B(7)	C(2)	D(9)